



# આધ્યાત્મિકતા અને પતંગ

~ ડૉ. અમીબહેન પટેલ (અમદાવાદ)

**પતંગ** રચિયા પતંગનો છુફ્ફો જોઈ પતંગ લેવીકે ના લેવીતે નક્કી કરે છે. છુફ્ફો ટાઈટ હોય એ પતંગ બરાબર ચહે નહીં એટલે એવી પતંગ ના ખરીદ. આધ્યાત્મિકતામાં પણ માનદૃપી છુફ્ફો ટાઈટ હોય તે ઉપર ઊઠી ન શકે. પણ સત્પુરુષકોઈ ભેદરાજ્યાવગર, કૃપાકરીને દરેકનો સ્વીકાર કરે છે.

પતંગની સ્થિરતા તેની કમાન પર આધારિત છે. તેમ આધ્યાત્મિકતામાં સ્થિરતા સત્પુરુષ સાથેના જોડાણ પર આધારિત છે. પવન ઓછો હોય તો દૂમકા મારવા પડે. દાથ પણ દુઃખી જાય. પવન બરાબર હોય તો ઢીલ મૂકે અને પતંગ સરસડાટ ઉપર ચેડે. આધ્યાત્મિક પ્રગતિમાં પ્રસંગ આવે ત્યારે ધૂન-ભજન અને નિર્દોષબુદ્ધિની ઢીલ છોડે તો સરસડાટ વધે. પ્રસંગે મુંજવણ આવે ત્યારે ધૂન-ભજન ઓછાં પડે અને પ્રભુને કર્તા-હર્તા ન મનાય તો સત્સંગમાં ટકી રહેવા સંઘર્ષ કરવો પડે, હારી જવાય. ક્યારે ઢીલ મૂકવી અને ક્યારે દૂમકા મારવા એ આવડી જાય તો ગમે તેવી પતંગ આકાશમાં ચઢી જાય. તેમ સત્સંગમાં ક્યારે શું પકડવું અને શું છોડવું તે આવડી જાય તો ગમે તેટલા કઠિન સમયમાં પણ તકલીફ ના પડે. આજ્ઞા અને સંતસમાગમ, ધૂન, નિર્દોષબુદ્ધિ પકડી રખાય અને અભાવ-અવગુણ છોડી દેવાયતો ગમે તેવા જટિલ પ્રસંગે પણ સત્સંગમાં આનંદરહે.

ફીરકી પકડનાર સાથીદાર ફીરકી એવી કુશળતાથી પકડે કે જ્યારે જરૂર હોય ત્યારે દોરીથી ઢીલ છોડે અને દોરી વીંટતી વખતે ગુંચ પડવા ન હે અને જો ગુંચ પડે તો ઉકેલી આપે. બે સારા સાધુ અને ત્રણ સારા હરિભક્ત સાથે સમાગમ હોય તો પ્રસંગે મુંજવણ આવે ત્યારે મહિમા અને ગુણગાન ગાઈ મુંજવણમાંથી બહાર કાઢી હે.

પતંગ ચગાવતી વખતે બીજા વચ્ચે જોળ નાંબે, કાપવા પણ આવે; દાથમાં ચીરા પણ પડે અને પીડા પણ થાય. પણ જે નો માં જો સારો હશે તેને કંઈ નહીં નહે. સત્સંગમાં દેહભાવ ટાળવા પ્રસંગ આવશે અને પીડા આપશે. જેની ધૂન-ભજન-કથાવાર્તા ઉપર પકડ હશે, આજ્ઞાદૃપી દોર જેણે પકડી રાજ્યો હશે અને સત્પુરુષને રાજુ કરવાની રૂચિ હશે તે દુસ્તાં રમતાં દેહભાવથી ઉપર ઊઠી જશે.

જેની પતંગ આકાશમાં સ્થિર થાય તે બીજાને સહેલનો આનંદ આપે; હવે તેને બીજુ કોઈ પતંગ વચ્ચે નહશે નહીં. એવી રીતે સત્સંગમાં જેની ઉપાસના દફ થાય તે પોતે સ્થિર થઈ જાય છે અને બીજાને સ્થિર થવામાં મદદરૂપ થાય છે. હવે અને પ્રસંગદુઃખી નહીં કરીશકે.

પતંગ જો ફાટે તો તેને સાંધવી પડે, નહીંતર ચેડે જ નહીં. તેમ જો સત્પુરુષનો અભાવ આવે તો તેને પ્રાયશ્ચિત્તરુદીપી પ્રાર્થના કરી ઓગણવો જ

પડે, નહીંતર સત્સંગમાં આગળ ના વધાય અને પડી જવાય. મૂળ દોરી સાથેનું પતંગનું જોડાણ છુટે તો પતંગ તુટે અને જમીન પર પટકાય. અક્ષરધામ તરફ ગતિ હોય ત્યારે જાગૃકતા ના રહે અને આજ્ઞાદૃપી દોરી અને ગુરુને રાજુ કરવાનો ભાવ છુટે તો નિશાન ચૂકી જવાય.

યોગીજી મહારાજ અને સંતો ઘરે પદ્ધાર્ય ત્યારે બાળ જશુ સંતસેવા અને સમાગમ મૂકી પતંગ ચગાવવાનો નિર્દોષ આનંદ માણવા સાથીદારો સાથે ગયા. આધ્યાત્મિક ઈતિહાસમાં કોઈ ગુરુએ પતંગ જેવી નિર્દોષ રમત છોડી દેવાની પોતાના શિષ્યને ભાષ્યે જ આજ્ઞાકરી હશે. ‘તમારામાં તલમાત્ર કસર નહીં રહેવા દાં.’ શ્રીજીના આ સંકલ્પને સાર્થક કરવા પ્રભુના સ્વરૂપ યોગીજી મહારાજે જશુને આવી આજ્ઞા આપી. ગુરુની આજ્ઞામાં દેહભાવ ટાળવાનું સામર્થ્ય હોય છે. શિષ્ય પણ એટલો જ કૃતનિશ્ચયી કે એ પળે જ ગુરુના વચન આગળ પતંગ ચગાવવાનો શોખ ગૌણ થઈ ગયો. બાળ જશુને પતંગ ચગાવવાનો જે ટલો આનંદ આવતો હતો તેનાથી અનંતગણો આનંદ ગુરુના વચને ગુરુને રાજુ કરવા સમર્પિત થવામાં આવતો હતો. આજ્ઞા, ઉપાસનાની દફતા, મહિમાયુક્ત સેવા, પ્રસંગે નિર્દોષબુદ્ધિ, ભગવાનનું અને ધૂનનું બળ લઈ બાળ જશુ અખંડ ચિદાકાશમાં રહેતા થઈ ગયા. સાહેબદાદાએ વર્ષો બાદ પાપ્યાજીની આજ્ઞાથી પતંગ ચગાવી અને તે પણ ભક્તોના આનંદ માટે સ્મૃતિ આપવાની કલ્યાણકારી અને દિવ્ય કિયામાત્ર હતી. તેમણે જીવનભર યોગીજી મહારાજની સ્મૃતિ અને આજ્ઞાદૃપી દોર પકડી રાખી યોગીજી મહારાજને રાજુ રાખવાનું અનુસંધાન રાખ્યું તોતેઓ પ્રભુને રહેવાનું ધામ બની ગયા. અને અત્યારે પોતાના ભક્તોને પ્રભુના આનંદની સહેલ આપી રહ્યા છે.

આપણે પણ નિયમ અને શિસ્તમાં રહી આજુ બાજુ વાળાની પતંગ કાચ્યા વગર તેમને પતંગ ચગાવવાનો આનંદ માણવા દઈએ તો આપણી પતંગ આકાશમાં ઊંચે પણ ચંડે અને સ્થિર પણ રહેશે. તેવી જ રીતે જીવનમાં કુસંગ, ઈર્ષા, વાદવિવાદ, ટીકાટિપ્પણ છોડી પ્રભુ અને ગુરુએ આપેલ નિયમ-ધર્મ પ્રમાણો જીવીશું તો અનેરી આધ્યાત્મિક ઊંચાઈ પ્રામ થશે અને ગુરુકૃપાથી સહેલે સહેલે આખંડ ચિદાકાશમાં રહેતા થઈ જવાશે.

મકરસંકાંતિ એટલે સૂર્યની દક્ષિણાથી ઉત્તર તરફ મકર રાશિમાં ગતિ. શુભ કાર્ય કરવા માટે ઉત્તમ સમય. જ્યારે જીવ સત્સંગમાં ગુરુને રાજુ કરવાના ભાવથી જીવે, ઉપાસના દફ હોય અને સંપ, સુહૃદભાવ તથા એકતા રાખી મંડે તો જીવભાવ ઓગળી જાય અને દિવ્યભાવમાં સંકમણ થઈ જાય. ◆